

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૧૨/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૮૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૩ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૭૮ લીટર દેશી દારૂ, ૧૯૭ બોટલ ઇંગ્લીશ દારૂ અને બિયર ટીન ૦૮ કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૧૪ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૯,૫૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૮૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઇન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૩૮૫/૧૬

વેજલપુર : લીલાબહેન વા/ઓ રણછોડભાઈ પરમાર (રહે, ઇંદ્રપ્રસ્થ- ૫, પ્રહલાદનગર ગાર્ડન પાસે સેટેલાઇટ) તા.૨૫/૧૨/૧૬ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે વાસણા એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાછળ મ્યુ.શાળા સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ લીલાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ લીલાબહેન પરમારે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.કોડીયાતર ચલાવે છે.

ઓઢવ : સુશીલાબહેન વા/ઓ જગદીશભાઈ વાઘેલા (રહે,જનતાનગર, મનમોહન ચાર રસ્તા પાસે, ઓઢવ) તા.૨૫/૧૨/૧૬ સાંજના ૭/૪૫ વાગ્યાના સુમારે ઓઢવ વિરાટનગર રોડ વારાહી સ્કુલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સુશીલાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુશીલાબહેન વાઘેલા એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં. ૨૩૮૬/૧૬

રિવરફ્રન્ટ (વેસ્ટ) :- મયુરકુમાર દુધાલાલ વોરા (ઉ.વ.૨૭)(રહે.ભાગ્યેશનગર, સંતોષનગરની બાજુમાં, અમરાઈવાડી) તા.૨૫/૧૨/૧૬ ના કલાક ૧૦/૨૦ વાગ્યા પહેલાં કોઈપણ સમયે ઈવેન્ટ સેન્ટરની પાછળ સાબરમતી નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી છે. આ અંગે રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી આલાભાઈ વજસીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.